

૬. ખાધા વિના ન ચાલે

કુટુંબના સભ્યોની ભૂમિકા, તેમની ટેવો, લક્ષણો, કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત, મૌખિક કે અન્ય રીતે કરે છે.

આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને માં જવાબ લખો.

૧. નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી ?

(અ) પાઉં (બ) રોટલી (ક) બિસ્કિટ (ડ) પુલાવ

૨. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે ?

(અ) ચોખા (બ) ઘઉં (ક) કાકડી (ડ) પાપડ

૩. નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખવાય છે ?

(અ) મકાઈ ડોડો (બ) ભાત (ક) રોટલી (ડ) અ અને ક બંને

૪. નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ ?

(અ) ઘાસ (બ) રોટલો (ક) સરગવો (ડ) આમળા

૫. ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે ?

(અ) અરવલ્લી (બ) વલસાડ (ડ) સાબરકાંઠા (ડ) ગાંધીનગર

વનસ્પતિ, પ્રાણીઓ, વૃક્ષો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતાં પરિવારોના વૈવિધ્યને સમજે છે.

નીચેના ખાદ્ય પદાર્થોનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો.

(રોટલો, મગનું પાણી, ચોખાના પાપડ, સાબુદાણાની ચકરી, દાળ દોકળી, ખીચડી, પિઝા, લાડવો, નુડલ્સ, કેરીનો રસ, ગાયનું દૂધ, બાફેલી મકાઈ, કેળા વેફર, લીંબુ શરબત)

કોણ ખાઈ શકે		
નાનું બાળક (૬ થી ૮ મહિના)	તમે	દાદા - દાદી